

ડાજી ડી.વી.અઘારીયા જાફરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં
'Essay Writing Competition'નું આયોજન

ડાજી ડી.વી.અઘારીયા જાફરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ ૮/૧૨/૨૦૧૭ના રોજ 'Essay Writing Competition'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિઢ્યાર્થીઓને 1.Study without Teachers 2. Youth Culture Today 3. Man v/s Machine. એમ ત્રણ વિષય આપવામાં આવ્યા હતા. વિઢ્યાર્થીઓને ૩૦ મિનીટમાં ૧૫૦ થી ૨૦૦ શબ્દોમાંની મર્યાદામાં પોતાના વિચારો વ્યક્ત કરવાના હતા. જેમાં વિઢ્યાર્થીઓએ પોતાની પ્રતિભા પ્રમાણે કવિઓના શબ્દોનો પ્રયોગ કરીને સરસ રજૂઆત કરી હતી. વિઢ્યાર્થીઓએ આજની યુવા પેઢી વિષે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના શબ્દો ટાંકતા લખ્યું હતું કે, "ઘટમાં ઘોડો થનગને અને આત્મા વિંઝે પંખ", "આ અણદિઠેલ ભૌમમાં યોવન મડિ આંખ". આજની યુવાન પેઢી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને લીધે અવળા માર્ગે જઈ રહી છે. ભોગવિલાસના સાધનોને લીધે વધુ ને વધુ આળસુ થતી જઈ રહી છે. આજના યુવાનને "શિક્ષિતની સાથે સાથે દિશાસૂચક" બનાવવાની જરૂર છે. તેમજ પોતાના નિબંધમાં શિક્ષકની મહત્વતા અને મહાનતા દર્શાવતા વિઢ્યાર્થીઓએ લખ્યું હતું કે, વિઢ્યાર્થી શિક્ષક વિના અભ્યાસ કરવામાં પાંગળું છે દરેક વિઢ્યાર્થીને 'ગુરૂ'ના યોગ્ય માર્ગદર્શનની જરૂર પડતી હોય છે અને ભારતીય સંસ્કૃતિમાં તો શિક્ષકને બીજા માતા-પિતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરૂનું પદ ખુબ આદરણીય ગણવામાં આવે છે. શિક્ષક પ્રત્યેનો આદરભાવ આપણા સંસ્કારોમાં ઘડાયેલો છે આથી શિક્ષકની આંગળી ઝાલીને સંસ્કારોનાં સિંચનથી દરેક વિઢ્યાર્થી શ્રેષ્ઠ સફળતા મેળવી શકે છે. આમ, વિઢ્યાર્થીઓએ પોતાના વિચારોની શ્રેષ્ઠ રજૂઆત 'નિબંધ', 'જેને કોઈ બંધન નથી' દ્વારા કરી હતી. પોતાના વિચારોની સુંદર રજૂઆત બદલ વિઢ્યાર્થીઓને પ્રથમ ત્રણ ક્રમ આપવામાં આવ્યા હતાં જે નીચે પ્રમાણે છે:

No.	Name	Class
1 st	Rathod Manishaben	TY BA
2 nd	Palsaniya Maherbanali H.	TY BCOM
3 rd	Sheliya Makbulfatema T.	SY BA